



ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ.૦૧

તા.૨૭.૧૨.૨૦૧૭

ફી નિયમન મુદ્દે હાઈકોર્ટનાં ચુકાદામાં રાજ્ય સરકાર,વાલી,
વિદ્યાર્થીઓની લાગણીનું પ્રતિબિંબ છે – ભરત પંડ્યા

શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી
નીતિનભાઈ પટેલ અને મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અભિનંદન

ભાજપ સરકાર અને વાલી-વિદ્યાર્થીઓના હિતની જીત થઈ છે – ભરત પંડ્યા

૨૦૧૮ના નવા વર્ષની ગુજરાતની જનતાને બહુ મોટી ભેટ મળી છે

શિક્ષણક્ષેત્રે ગુજરાતનો આ નિર્ણય દેશને દિશા આપશે - ભરત પંડ્યા

કોંગ્રેસ અને રાહુલ ગાંધીના શિક્ષણ અને રોજગારના જૂઠ્ઠાણા અને અપપ્રચાર સામે ગુજરાતની
જનતાના ચૂકાદા પછી ન્યાયની અદાલતે પણ જવાબ આપી દીધો છે – ભરત પંડ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ ફી નિયમન મુદ્દે હાઈકોર્ટનાં ચુકાદાને સહર્ષ
આવકારતાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટનો આ ચુકાદો રાજ્ય સરકાર,વાલી,વિદ્યાર્થીઓની લાગણીનું
પ્રતિબિંબ છે.

રાજ્ય સરકારે વાલી અને વિદ્યાર્થીઓનાં હિતમાં લીધેલ પગલાંને હાઈકોર્ટે સ્વીકાર્યો છે. વાલી -
વિદ્યાર્થીઓનાં હિતની જીત છે. ૨૦૧૮ના નવા વર્ષની ગુજરાતની જનતાને બહુ મોટી ભેટ મળી છે.
શિક્ષણક્ષેત્રે ગુજરાત ભાજપ સરકારનો આ નિર્ણય દેશને દિશા આપશે.



ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

//૨//

શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે વાલી, વિદ્યાર્થીઓના હિત માટે શુદ્ધ ઈરાદાથી નિર્ણય લીધો હતો જેને આજે નામદાર હાઈકોર્ટે મંજૂરીની મહોર મારી છે ત્યારે ભાજપ સરકાર આ ચૂકાદાને ધ્યાનમાં રાખીને ફિ નિયમનને ત્વરિત અમલી બનાવશે. શાળા સંચાલકોએ આ નિર્ણયને સ્વીકારીને વાલી, વિદ્યાર્થીઓની લાગણીઓને માનીને માન આપવું જોઈએ.

શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ફી નિયમનના અમલથી ગુજરાતની મધ્યમવર્ગની જનતાને ફીની ચુકવણીમાં આર્થિક સારો ફાયદો થશે તેમજ રાજ્યના લગભગ 37.60 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે અને ખાનગી શાળાના સંચાલકોની મનમાની બંધ થશે.

ગુજરાતના વિદ્યાર્થીઓના હિત માટે ફી નિયમન કાયદાને નામદાર હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાને ખૂબ ખૂબ અભિનંદન..

પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ કોંગ્રેસ સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ચૂંટણી સમયે જૂઠ્ઠાણાં ફેલાવવા અને અપપ્રચાર કરવામાં રસ હતો. કોંગ્રેસે અને રાહુલ ગાંધીએ ફી નિયમન, બેરોજગારી, શિક્ષણ જેવા મુદ્દાઓ પર જૂઠ્ઠા આંકડાઓ જાહેરમાં આપીને જોરશોરથી ચૂંટણીમાં અપપ્રચાર કરીને ગુજરાત અને ભાજપને બદનામ કરવાં પ્રયાસ કર્યો હતો તેનો જવાબ આ ચૂકાદાએ આપ્યો છે. છેવટે આજે નામદાર હાઈકોર્ટના ચુકાદાથી “દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે”. કોંગ્રેસને ચૂંટણીમાં હાર આપીને ભાજપને સતત છઠ્ઠીવાર જીત આપીને કોંગ્રેસને જનતાની અદાલતે વિધાનસભાની ચૂંટણી ચૂકાદો આપી દીધો અને કોંગ્રેસના અપપ્રચાર સામે ન્યાયની અદાલતે પણ જવાબ આપી દીધો છે. હવે, જૂઠ્ઠાણા ફેલાવવા અને ભાજપ વિરૂદ્ધ અપપ્રચાર કરવાનું કોંગ્રેસ બંધ કરે તેમ શ્રી પંડ્યાએ જણાવ્યું હતું.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર - મીડિયા સેલ